

**B.A. Semester - 5 (Remedial) (CBCS) Examination
March/April-2025 (NEW COURSE)**

ECO P15 Banking and Financial Market-1(Core -15)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ ભારતમાં વ્યાપારી બેન્કોનાં રાષ્ટ્રીયકરણનાં કારણો સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ ભારતમાં રાષ્ટ્રીયકૃત વ્યાપારી બેન્કોની સિદ્ધિઓ સમજાવો.
- પ્રશ્ન-૨ નાબાર્ડનું (NABARD) મહત્વ અને કાર્યો સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ નાણાંબજારનો અર્થ અને પ્રકારો સમજાવો.
- પ્રશ્ન-૩ નાણાંબજારના લક્ષણો સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ નાણાંની માંગ એટલે શું? નાણાંની માંગના હેતુઓ સમજાવો.
- પ્રશ્ન-૪ નાણાંનો પુરવઠો એટલે શું? નાણાંનાં પુરવઠાના ઘટકો સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ ભારતીય બેન્કિંગ માળખાને વિસ્તૃત સમજાવો.
- પ્રશ્ન-૫ ટ્રેકનોંધ લખો. (કોઈપણ બે) (૧૪)
- 1) તરલતાનો ફાંસલો.
 - 2) નાણાંના પુરવઠાને અસર કરતા પરિબળો.
 - 3) પ્રાદેશિક ગ્રામીણ બેંકો
 - 4) રાષ્ટ્રીયકૃત બેન્કોની મર્યાદાઓ

ENGLISH VERSION

- Que-1 Explain reason of Nationalization Commercial Bank in India. (14)
OR
- Que-1 Explain the Achievement of Nationalized Commercial Banks in India.
- Que-2 Explain the Importance and Functions of NABARD. (14)
OR
- Que-2 Explain the Meaning and Types of Money Market.
- Que-3 Explain characteristics of money market. (14)
OR
- Que-3 What is Demand for Money? Explain the Objectives of Money Demand.
- Que-4 What is Money Supply? Explain the Components of money Supply. (14)
OR
- Que-4 Explain the Indian Banking Structure in detail.
- Que-5 Write Short Note. (Any Two) (14)
- 1) Liquidity Trap.
 - 2) Factors Affecting of Money Supply.
 - 3) Regional Rural Banks.
 - 4) Limitations of Nationalized Banks.
